



The Baroda *Rayon* Corporation Ltd.

CIN L45100GJ1958PLC000892

P O Fatehnagar, Udhna, Surat 394 220

Tel : 0261-2899555

Email : admin@brcl.in, brcsurat@gmail.com

Website : www.brcl.in

01st June, 2023

To,
Department of Corporate Services,
BSE Limited
P. J. Towers, Dalal Street,
Mumbai – 400 001.

**Sub – Newspaper Advertisement – Publication of Financial Results of the company for
the quarter and year ended 31st March, 2023.**

Ref – (Scrip code – 500270)

Dear Sir,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of the financial results of the company for the quarter and year ended 31st March, 2023 published in Financial Express (English) and Pratap Darpan (Gujarati) newspapers.

Request you to kindly take the same on your record.

Thanking you,

Yours faithfully,

For The Baroda Rayon Corporation Limited

Kunjal Desai
Company Secretary
ACS-40809

Encl: As Above

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31-Mar-23	31-Mar-22	31-Mar-23	31-Mar-22
1	Total Income from Operations	14,474	9,567	13,777	47,734
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(2,373)	(3,632)	(1,532)	(11,588)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(5,576)	(7,803)	(1,575)	(18,962)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(7,545)	(7,803)	(1,439)	(20,930)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(7,653)	(7,803)	(1,485)	(21,038)
6	Paid-up Equity Share Capital (F.V. of ₹ 10/- each)	87	87	87	87
7	Reserves (excluding Revaluation Reserve) *	(46,650)	(38,997)	(25,612)	(46,650)
8	Securities Premium Account	4,962	4,962	4,962	4,962
9	Net worth	(46,563)	(38,910)	(25,524)	(46,563)
10	Paid up Debt Capital/ Outstanding Debt	56,522	56,522	56,522	56,522
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-
12	Debt Equity Ratio	-1.62	-1.87	-2.53	-1.62
13	Earnings Per Share (F.V. of ₹ 10/- each)				
	Basic	-863.41	-892.90	-223.00	-2,395.18
	Diluted	-690.73	-714.32	-187.22	-1,916.15
14	Capital Redemption Reserve	-	-	-	-
15	Debt Redemption Reserve	-	-	-	-
16	Debt Service Coverage Ratio	0.37	0.02	0.48	0.20
17	Interest Service Coverage Ratio	0.37	0.02	0.53	0.20

* Includes of Rs. -13,224 lakhs of Slump Sale Adjustment Deficit Account

NOTES:
1. The Financial Results for the quarter and year ended March 31, 2023 have been reviewed by Audit Committee and approved by the Board of Directors at its meeting held on May 30, 2023.
2. The above is an extract of the detailed format of quarterly and year ended financial results filed with the Stock Exchanges under Regulation 52 of the LODR Regulations. The full format of the quarter and year ended financial results are available on the websites of the Stock Exchange(s) (www.bseindia.com) and the Company's website (www.setcoauto.com).
3. For the other line items referred in Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, pertinent disclosures have been made to the BSE Limited and can be accessed on www.bseindia.com.

For and on behalf of the Board
Harish Sheeth
Chairman & Managing Director
DIN: 01434459
Place: Kalo
Date: May 30, 2023

Sr. No.	PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
		31.03.2023	31.03.2022	31.03.2023	31.03.2022
1	Total Income from Operations (net)	2153.83	1609.45	7481.87	5837.04
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	383.68	9.22	428.39	58.37
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	383.68	9.22	428.39	58.37
4	Net Profit / (Loss) for the period after tax (after-Exceptional and/or Extraordinary items)	281.31	8.44	316.12	40.91
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	281.31	8.44	316.12	40.91
6	Equity Share Capital	150.00	150.00	150.00	150.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	2682.29	2366.17
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
	1. Basic	18.75	0.56	21.07	2.73
	2. Diluted	18.75	0.56	21.07	2.73

NOTE :-
1. The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter & year ended 31st March, 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the website of the Stock Exchange(s). BSE: www.bseindia.com and the Company's website: www.betexindia.com.

For, BETEX INDIA LIMITED
Manish Somani
WHOLETIME DIRECTOR
CIN: L17119GJ1992PLC018073
436, GIDC, Pandesara, Surat-394221, Gujarat, INDIA.
Ph.: (91-261) 2898595, FAX : (91-261) 2334189, E-mail : corporate@betexindia.com

Sr. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Year Ended
		31/03/2023	31/03/2022	31/03/2023
1	Total Income From Operation	24.73	16.57	51.99
2	Net Profit for the period (before tax and exceptional items)	16.24	11.58	28.77
3	Net Profit / (Loss) for the period before Tax (after exceptional items)	18.88	13.40	34.47
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	15.76	10.59	28.90
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	16.18	10.49	29.32
6	Equity Share Capital (Face Value of Rs. 10/- each)	313.18	313.18	313.18
7	Reserve (excluding Revaluation Reserve)	-	-	792.47
8	Earnings Per Share (EPS) (of Rs. 10/- Each) (for continuing and discontinued operations) not annualised	0.50	0.34	0.92
	(a) Basic	0.50	0.34	0.92
	(b) Diluted	0.50	0.34	0.92

NOTES:
1. The above is an extract of the detailed format of Quarterly/Year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Year ended Financial Results are available on the website of the stock exchange, website www.bseindia.com.
2. The Company is engaged in the business of Construction and Development of housing projects and therefore there are no other reportable segments.

PLACE : AHMEDABAD
DATE : May 30, 2023
BY ORDER OF THE BOARD
RUSHABHAI N. PATEL
MANAGING DIRECTOR (DIN: 00047374)

Sl. No.	Particulars	Current Quarter Ended	Corresponding 3 month ended in the previous year	Year to date figure ended
		30.06.2022	30.06.2021	31.03.2022
1.	Total income from operations (Net)	-	-	-
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(0.18)	(10.60)	(11.20)
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(0.18)	(10.60)	(11.20)
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.18)	(10.60)	(11.20)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after Tax))	(0.18)	(10.60)	(11.20)
6.	Paid - up Equity share capital (Face value Rs. 10/- each)	304.66	304.66	304.66
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -			
	1. Basic:	(0.01)	(0.35)	(0.37)
	2. Diluted:	(0.01)	(0.35)	(0.37)

NOTES:
1. The above is an extract of the detailed format of quarterly/annual financial results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly unaudited financial results are available on the Stock exchange website (www.bseindia.com) and the company's website (www.chplindustries.com).
2. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 29th May, 2023.

For and on behalf of
Callista Industries Limited
(Formerly Known as CHPL Industries Limited)
Sd/-
Rashmi Ravi Sharma
Managing Director
DIN: 06618645
Date: 29/05/2023
Place: Surat

SBI STATE BANK OF INDIA
Stressed Assets Management Branch : Paramsidh Complex, 2nd Floor, Opp. V.S. Hospital, Ellisbridge, Ahmedabad-380006. Phone: 079-26580794, E-mail: sbi.04199@sbi.co.in & team4samb.ahm@sbi.co.in
Authorised Officer's Name: Shri Viveka Nand. Mob: 9979892750

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES
Appendix - IV-A [See Provision to 8(6)]

E-auction Sale Notice For Sale Of Immovable Assets Under The Securitization And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 Read With Proviso To Rule 8(6) Of The Security Interest (enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable assets charged/ mortgaged to the Secured Creditor, the Symbolic Possession of which has been taken by the Authorised officer of State Bank of India, the Secured Creditor, will be sold on "As is Where is", "As is What is" and "Whatever there is" basis on 20.06.2023 for recovery of Rs. 14,16,17,397.00 as on 28.02.2019 and interest, expenses & costs thereon and thereafter of SBI, as per to pay vide demand Notice dated 02.03.2019 less : Recoveries, from M/s. Gururupa Corporation (Borrower) and Shri Rakesh Ravjibhai Desai (Partner & Guarantor), Shri Parimal Jivanbhai Savalia (Partner & Guarantor) and Shri Kalpesh Ravjibhai Desai (Guarantor)

Date & Time of public E-Auction 20.06.2023 from 11.00 AM to 14:00 PM with unlimited extension of 10 minutes each.

Property ID No	Detail of Property	Reserve Price (Rs.)*	Earnest Money Deposit (Rs.)	Bid increase Amount (Rs.)	Date & time of inspection
SBIN0779873847	All these pieces or parcels of project Land and Building known as Skydeck situated at Greenland Resort, Near Sanskar Vidyalaya, Kadodara, Palsana road, Moje Baleswar, Ta : Palsana, Dist : Surat bearing Revenue Survey No. 435, Block No 341, Khata No 1448, Pali 1, Sub Plot No 2-B, admeasuring 8818.95 Sq Mtr (Building A+B+C+D+E+F+G+H Incomplete Project) together with undivided proportionate share in land admeasuring 4602.48 sq. mtrs. in the name of M/s Gururupa Corporation, (Original Land Survey No 354, Block No-341, Khata No-1448 admeasuring 34095 sq. mtrs.)	23,11,00,000/-	2,31,10,000/-	10,00,000/-	14.06.2023 12.00 p.m. to 14.00 p.m.
	2. Sub Plot No 2-A, Land admeasuring 8825.18 sq.mtrs. together with undivided proportionate share in land admeasuring 4605.74 sq.mtrs. in the name of Shri Rakesh Ravjibhai Desai				
	3. Sub Plot No 1, Land admeasuring 7242.65 Sq mtrs. in the name of Shri Kalpesh Ravjibhai Desai and Shri Parimal Jivanbhai Savalia				

All above mortgaged properties shall be put on e-auction in one lot only
Applicable GST/TDS will be borne by successful buyer over and above bid amount.
Encumbrances: There are no other encumbrances advised to the Bank. The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of properties put on auction and claims/ rights/ dues/ affecting the property, prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorised Officer/ Secured Creditor shall not be responsible in any way for any third-party claims/ rights/ dues.
For detailed terms and conditions of the sale, please refer to the link provided in State Bank of India the Secured Creditor Website www.sbi.co.in and <https://www.msccomerce.com/auctionhome/ibapi/index.jsp>, <https://ibapi.in>, or contact-9979892750 & 7600070031
The Bidders should get themselves registered on <https://www.msccomerce.com/auctionhome/ibapi/index.jsp> By providing requisite KYC documents and registration fee as per the practice followed by M/s MSTC Ltd. well before the auction date.
Last Date and Time within which request Letter/KYC/EMD to be remitted: Before auction date.
Date: 29.05.2023, Place : Ahmedabad
Sd/- Authorized Officer, State Bank of India.

SBI भारतीय स्टेट बैंक College Road Visnagar-384315
State Bank of India Email : sbi.60246@sbi.co.in

POSSESSION NOTICE (See Rule 8(1) [for Immovable Property])

Whereas, The undersigned being the Authorised Officer of State Bank of India - College Road Visnagar, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act], 2002 and in exercise of powers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security calling Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 02/02/2022 upon the borrower/s Smt. Anandibh Kanugri Goswami to repay the amount mentioned in the notice being Rs. 55,666.00 (Rupees Five lac Fifty Five Thousand Six Hundred Sixty Six Rupees Only) as on 02/02/2022 + further interest at the contractual rate and incidental expenses, costs, charges etc. thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, legal heirs (known unknown), legal representatives (known-unknown), guarantor and the public in general that the undersigned has taken **SYMBOLIC POSSESSION** of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said [Act] read with Rule 8 of the said rules on this 23rd day of May of the year 2023.

The borrower, legal heirs (known unknown), legal representatives (known unknown), guarantor and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of State Bank of India - College Road Visnagar, for an amount of **Rs. 55,666.00 (Rupees Five lac Fifty Five Thousand Six Hundred Sixty Six Rupees Only)** as on 02/02/2022 with further interest and incidental expenses, costs, charges etc. thereon.

The borrower's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of Mortgaged property
All that piece and parcel of Padharyia, property, Old R.S No.158 & New R.S.No.202, Plot no 1 Arya 96.75sq.mtr.Village At Padharyia Tal.: Dist: Mahesana -ries of the said immovable property are as under: East By: Open Land Of Margin, West By: Internal Way, North By: Open Land of Margin, South By: Plot No. 2
Date : 31-05-2023
Place : Mehsana
Authorised Officer
Chief Manager
State Bank of India

THE BARODA RAYON CORPORATION LIMITED
Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394222 (T/0261-2899555E
mail-brcsurat@gmail.com, admin@brc.in | CIN - L45100GJ1958PLC000892 | Website-www.brc.in

Extract of Standalone Audited Financial Results for the Quarter & year ended 31st March, 2023 (₹ in lakhs)

Sr. No.	Particulars	Quarter ended	Quarter ended	Quarter ended	Year ended	Year ended
		31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022
1	Total income from operations	3710.75	753.25	-	5844.00	-
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	621.69	23920.46	34278.79	25699.35	36210.03
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	2296.68	23920.46	35527.13	27274.34	37458.57
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	2296.68	23920.46	35527.13	27274.34	37458.57
5	Total comprehensive Income for the period (comprising Profit/Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	2296.68	23920.46	(9254.04)	27274.34	37458.57
6	Equity Share Capital	2291.14	2291.14	2291.14	2291.14	2291.14
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year	-	-	-	27482.21	207.89
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)					
	Basic:	10.02	104.40	155.06	119.04	163.49
	Diluted:	10.02	104.40	155.06	119.04	163.49

NOTES:
The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Quarterly & year to date Financial Results are available on the Bombay Stock Exchange websites. (www.bseindia.com) and company's website www.brc.in.

For The Baroda Rayon Corporation Limited
Sd/-
Damodarbh Patel
Managing Director
DIN-00056513
Date : 30-05-2023
Place : Surat.

EQUITAS SMALL FINANCE BANK LTD.
(FORMERLY KNOWN AS EQUITAS FINANCE LTD)
Registered Office: No.769, Spencer Plaza, 4th Floor, Phase-II, Anna Salai, Chennai TN - 600 002. ☎ 044-42995000, 044-42995050
Branch : 305-306, 3rd Floor, Abhisree Adroit, Near Sunrise Mall, Mansi Circle, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad, Gujarat 380015

DEMAND NOTICE
NOTICE UNDER SECTION 13 (2) OF THE SARFAESI ACT, 2002

NOTICE is hereby given that the following borrower/s have availed loan from Equitas Small Finance Bank Ltd (ESFB). The said borrower/s had/have failed to pay installments and their loan account has been classified as Non-Performing Asset as per the guidelines issued by RBI. The details of the secured immovable properties, loan and the amounts outstanding as on date payable by the borrower/s are mentioned below. The borrower(s) and the public in general are informed that the undersigned being the Authorized Officer, the secured creditor has initiated action against the following borrower/s under the provisions of the SARFAESI Act, 2002 and not to deal with the said property, on failure to repay the outstanding dues indicated against their names within 60 (Sixty) days of this notice, the undersigned will exercise any one or more of the powers under sub-section (4) of Section 13 of the SARFAESI Act, including power to take possession of the properties and sell the same.

Name of the Borrower(s)/ Guarantor(s) (Name of The Branch)	Demand Notice Date and Amount	Description of Secured Asset (Immovable Property)
Loan No.: 700000518076/EMFMSNA0027384 & 700000390865/ELPMHSNA0027385. 1. Mr. Sipai Abbulkhan Bassanbhai S/o Mr. Bassanbhai (Applicant/Borrower & Mortgagor). Also at: Shanin, Nr. Essar Petrol Pump, Sutanpur, Patan- 384268. And Madani Developers, 35- Khansarovar Road, Patan- 382468. 2. Mrs. Salma W/o Mr. Bassanbhai (Co-Applicant/ Co-Borrower & Mortgagor) Also at: Basan, Ganwari, Gaomri, Bharatpur, Kaman, Rajasthan- 321023. 3. Mr. Yunushbhai Abubakkar Maman W/o Mr. Abubakkar (Co-Applicant/ Co-Borrower & Mortgagor) Having Address At: A-402, Madani Developers, Khansarovar Road, Patan-384265. All Add.: B-304, 3rd Floor, Madani Developers, Khansarovar Road, Patan-384265.	20/05/2023 & Rs. 7,31,279/- as on 18.05.2023. & NPA on 10/04/2023	Schedule Of The Security (s) Residential Property Owned By Mr. Sipai Abbulkhan Bassanbhai All that the residential property bearing revenue survey no. 10 palki city survey no. 35 city survey no. 2988/2/B/14 on 3rd floor, flat No. B-304, total area admeasuring in aggregate about 37.12 sq. mtrs situated at "Madni Flat" sandesarpati of patan, Ta-Dist-Patan, North Gujarat. Four corners of said property:- North: Margin land, South: Flat no. B-303, East: Margin land West: Passage
Loan No: 700005579743/EMFAMDB0039019 & 700005585143/ELPAMDB0039020 1. Mr. Rakesh Kumar S/o Mr. Ram Singh (Applicant/Borrower & Mortgagor) 2. Mrs. Sitohana W/o Mr. Rakesh Kumar (Co-Applicant/ Co-Borrower & Mortgagor) All Add.: E-604, Swastik Platinum, Opp- Nakshatra Heights B/s- Kamnari Apartment, Narol, Ahmedabad- 382405. Also at: Paharsar, Churu, Paharsar, Rajasthan- 331023. And B-303, 3rd Floor, Sudev Flora, B/h- Bhagwat, Narol, Ahmedabad-382405.	20/05/2023 & Rs. 19,70,526/- as on 18.05.2023 & NPA on 10/04/2023	Schedule Of The Security (s) Residential Property Owned By Mr. Rakesh Kumar S/o Ram Singh & Sitohana W/o Rakesh Kumar All that piece and parcel of immovable being unit no. B-303 on the admeasuring 66.89 sq. mtrs, i.e. 80 sq. yards total area alongwith 14.64 sq. mtrs. undivided land share in the scheme known as "SUDEV FLORA" immovable non agriculture land adm. 1692 sq. mtrs. (as per sale deed no. 655/2015 in scheme known as sudev flora, situated at amalgamated survey no. 455(old survey no. 455 and 456) F.P.No. 13/2 palki F.P.No. 13/2/1 and F.P.No.13/2/2 palki F.P.No. 13/2/2 of T.P. No. 80 of Mouje: Vatva, Tal- Vatva and Dist- Ahmedabad. Four corners of said property:- North : Flat No B/302, South: Flat No B/304, East: Flat No. B/306, West: Flat No. B/306
Loan No: 700004393990/EMFAMDB0032998 & 700004393537/ELPAMDB0032999 1. Mr. Parthv Suthar S/o Mr. Rajendra Suthar (Applicant/Borrower & Mortgagor) Also at: 19, Pancharnutr Estate, Nr- Memco Bridge, Memco Cross Road, Memco, Ahmedabad- 380025. 2. Mrs. Sudhanben Gajjar W/o Mr. Rajendra Suthar (Co-Applicant/ Co-Borrower & Mortgagor) All Add.: A-301, Vrundanavani, Opp- Swaminarayan Family, Haridasthan, Naroda, Ahmedabad-382330. Also at: A-306, Pancharnutr Residency, Opp- Raspan Arcade, Nikol, Ahmedabad- 382350. And D-101, Royal Rejoice-2, B/h- IOC Petrol Pump, Nikol, Ahmedabad- 382330.	20/05/2023 & Rs. 10,10,435/- as on 18.05.2023 & NPA on 10/04/2023	Schedule Of The Security (s) Residential Property Owned By Mr. Parthv Suthar S/o Rajendra Suthar & Sudhanben Gajjar W/o Rajendra Suthar All that piece and parcel of immovable being flat no. D1- 101 on the 1st floor, 14.96 sq. mtrs, land carpet area & 54.08 sq. mtrs. construction carpet area in the scheme known as "ROYAL REJOICE-2" land admeasuring about 4483 sq. mtrs of final plot no. 20 part of town planning scheme no. 109/land of block no. 30 of old block no. 91) situate, lying and being at mouje bilasiya, Tal- Dasroi, in the registration district of Ahmedabad and sub district of Ahmedabad-12(Nikol). Four corners of said property:- North : Flat no. D-104, South : Society margin, East : Society margin, West: Flat no. D-102

Place : Ahmedabad
Date : 31.05.2023
Sd/- Authorized Officer
Equitas Small Finance Bank Ltd.

SBFC SBFC Finance Limited
Registered Office:- Unit No. 103, First Floor, C&B Square, Sangam Complex, Village Chakala, Andheri- Kurla Road, Andheri (East), Mumbai-400059.

POSSESSION NOTICE
(As per Rule 8(2) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas the undersigned being the Authorized Officer of SBFC Finance Limited under the Securitization, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 8 of the Security Interest (Enforcement) rules 2002, issued Demand Notices upon the Borrower/Co-borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrower/Co-borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under section 13(4) of the said Act with Rule 8 of the said rules on the below-mentioned dates.

The Borrower/Co-borrowers in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of SBFC Finance Limited.

Name and Address of Borrowers & Date of Demand Notice	Description of Property(ies) & Date of Possession	Amount demanded in Possession Notice (Rs.)
1. Pravinbhai Ukabhai Vaghasiya, 2. Jyotsnaben Pravinbhai Vaghasiya, both having address at Shreenath tower 1, Gundala Road, Patan Colony, Gondal, Rajkot, GUJARAT - 360311. Demand Notice Date: 20th August 2021 Loan No. 0640008409DH (PR00683863)	ALL THE PIECE AND PARCEL OF PROPERTY BEARING FLAT ON GROUND FLOOR (FLAT NO.1) HAVING A BUILT UP AREA 99-05 SQ METERS IN THE BUILDING NAMED "SHREENATH TOWER" CONSTRUCTED ON LAND AREA 407-53 SQ METERS I.E., 487-41 SQ YARDS OF PLOT NO 46 447 SITUATED AT GONDAL REVENUE SURVEY NO 476, SUB DIST - GONDAL, DIST - RAJNAT AND BOUNDED AS PER SALE DEED :- NORTH - MARGINAL SPACE THEN PLOT NO 45, SOUTH - MARGINAL SPACE THEN ROAD, EAST - MARGINAL SPACE THEN PLOT NO 32, WEST - MAIN ROAD OF FLAT. AS PER SITE NORTH- MARGIN THEN ROAD, SOUTH- MARGIN THEN PLOT NO.45, EAST-MARGINAL SPACE, WEST- MAIN DOOR MARGIN THEN ROAD. Date of Possession: 26-May-2023	Rs.3279550/- (Rupees Thirty Two Lakh(s) Seventy Thousand Nine Hundred Fifty Only) as on 14th Feb 2023
1. Suresh Kumar D Solanki, 2. Bhavesh Sureshbhai Solanki, 150 Feet Ring Road, Sathadhar Park-2, Near Nanavati Chowk, Rajkot, Gujarat - 360007. Demand Notice Date: 14th October 2021 Loan No. 0640007552DH (PR00683866)	All the piece and parcel of property bearing Residential House having a land area 167-22 square meters i.e., 200 square yards towards the Northern side of Plot no 15 situated at Sayla Revenue survey no 925/1 in sub-dist - Sayla, Dist - Surendranagar and bounded as - North - Canal, South 6 meters road, East - Remaining land of this plot, West - Plot no 61. 	

માણસા લંટ કેસના આરોપીને સુરત કાર્મ બ્રાંચે ઝબ્બે કર્યો

ઓપીને સુરત પોલીસ ગાંધીનગર પોલીસને સોંપી દેશે

પ્રતાપ પ્રતિનિધી સુરત, તા. ૩૧ ઓપીને સુરત કોલેજના માસ્ટર પોલીસ સ્ટેશનની હદમાં થયેલી ઘટના અંગેની ગુનામાં નાસના કરતા આરોપીને ગુજરાતીના દિવસોમાં સુરત કોઈમ બ્રાંચે ઝબ્બે પાડ્યો હતો.

સુરત શહેર પોલીસ કમિશ્નરે તબાહી કરવાના આરોપીને ગુનામાં નાસના કરતા આરોપીને ગુજરાતીના દિવસોમાં સુરત કોઈમ બ્રાંચે ઝબ્બે પાડ્યો હતો.

પો. સ્ટે.ના રાહબંધી કેસ, પોલીસ સમ ઈન્ચેક્ટરની ટીમે બનાવી વર્કઆઉટમાં હતા દરમ્યાન માત્રથી હકીકત આધારે ગંભીર ગુનામાં માસ્ટર પો. સ્ટે. ગુનાના કામે નાસતો કરતો આરોપી ભરતજી ઉર્ફ ડી. ડી. દાશરથ ઠાકોર ઉર્ફ ડી. ડી. દાશરથ ઠાકોર સેવા (રહે. ગામ-માસા, માલગ તળાવ, તાલુકા પરા (વાસ) તા. માસા જી. ગંધીનગર)ને આઈપીઆર પકડી પાડવામાં આવેલ છે.

મુજબ પકડાયેલ આરોપીની ઇજારા કરતા જણાવેલ કે ગઈ તા. ૨૪/૦૫/૨૦૨૩ ના રોજ બપોરના આશરે ૨૩ વાગેના સુમરે કરીયાદી સાગરભાઈ રોડે દુકાને જઈ ઉધારથી પોતાની ગંધીનગરને આઈપીઆર પકડી પાડવામાં આવેલ છે.

અંકલેશ્વર તાલુકાનું ધો. ૧૨નું ૭૫.૮૩ ટકા પરિણામ જાહેર થયું

અંકલેશ્વર તા. ૩૧ આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ (નાર) અને ધોરણ ૧૨ વીરણાં પરીક્ષાના પરિણામ જાહેર કરાયું છે. જેમાં અંકલેશ્વરમાં આ વર્ષે ૭૫.૮૩ ટકા જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૩ની ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ (નાર) અને ધોરણ ૧૨ વીરણાં પરીક્ષાના પરિણામ જાહેર કરાયું છે. જેમાં અંકલેશ્વરમાં આ વર્ષે ૭૫.૮૩ ટકા જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ (નાર) અને ધોરણ ૧૨ વીરણાં પરીક્ષાના પરિણામ જાહેર કરાયું છે. જેમાં અંકલેશ્વરમાં આ વર્ષે ૭૫.૮૩ ટકા જાહેર કરવામાં આવ્યું છે.

નવસારીનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૭૨.૬૭ ટકા પરિણામ

નવસારી જિલ્લા માં માર્ચ મહિનામાં લેવામાં આવેલ ધો ૧૨ એચ. એસ. સી બોર્ડના પરીક્ષા સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરાયું છે. જેમાં નવસારી જિલ્લામાં ૭૨.૬૭ ટકા પરિણામ જાહેર કરાયું છે.

નવસારી જિલ્લામાં ૭૨.૬૭ ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં નવસારી જિલ્લામાં ૭૨.૬૭ ટકા પરિણામ જાહેર કરાયું છે.

સુગાનામાં સ્વામિન્ય પહેલા પાળાનું યાત્રુ

સુગાના મુલ્યાની વિરુદ્ધ સંગઠનના સભ્ય દેશીના વિદેશ મંત્રીઓની બેઠક આરોપી કરી હતી. ગોવામાં મળેલી આ બેઠકમાં તમામ સભ્ય દેશીના વિદેશ મંત્રી વ્યક્તિગત રીતે સામેલ થયા હતા જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ભિલાવેલે ટુટ્ટે ગઈરી પત્ર હાથર રહ્યા હતા. ભિલાવેલે એસીઆઈની બેઠકમાં ભાગ લેવા માટે જ મેનાં રોજ યાત્રા આપ્યા હતા, જે વર્ષ ૨૦૧૧ પછી પાકિસ્તાનના કોઈ મોટા નેતાની પહેલી યાત્રા આવી હતી.

પર પ્રકાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જો સ્ત્રીયોગ મારા હાથમાં છે તો તેમને શા માટે દુઃખ થાય છે?

વલસાડમાં સોમિયો પહેલા પાળાનું યાત્રુ

સોમિયો વાંકાંકા પુલની બાજુથી આવી રહી હતી. ગુલબંદ મંદિરથી લગભગ ૧૦૦ મીટર પહેલા સ્ટુટી અચકાઈ મળતા સ્ટુટી સવારો સોમિયોની નીચે આવી ગયા હતા. સોમિયોમાં ક્ષાઈને સ્ટુટી અને લોકો ખેંચાઈ રહ્યા હતા. જોરથી ચીસ પડવાનો અવાજ આવ્યો. ટણખા ઉડતા હતા. સદનસીબે અણ લાગી ન હતી.

સુરત ચોરસી આદિત્ર ટ્રસ્ટના હોદ્દાદારની વરસી

સુરત-સુરત ચોરસી આદિત્ર ટ્રસ્ટના હોદ્દાદારની વરસી કરવામાં આવી હતી.

સુરત-સુરત ચોરસી આદિત્ર ટ્રસ્ટના હોદ્દાદારની વરસી કરવામાં આવી હતી.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

સુગાનામાં સ્વામિન્ય પહેલા પાળાનું યાત્રુ

સુગાના મુલ્યાની વિરુદ્ધ સંગઠનના સભ્ય દેશીના વિદેશ મંત્રીઓની બેઠક આરોપી કરી હતી. ગોવામાં મળેલી આ બેઠકમાં તમામ સભ્ય દેશીના વિદેશ મંત્રી વ્યક્તિગત રીતે સામેલ થયા હતા જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ભિલાવેલે ટુટ્ટે ગઈરી પત્ર હાથર રહ્યા હતા. ભિલાવેલે એસીઆઈની બેઠકમાં ભાગ લેવા માટે જ મેનાં રોજ યાત્રા આપ્યા હતા, જે વર્ષ ૨૦૧૧ પછી પાકિસ્તાનના કોઈ મોટા નેતાની પહેલી યાત્રા આવી હતી.

પર પ્રકાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જો સ્ત્રીયોગ મારા હાથમાં છે તો તેમને શા માટે દુઃખ થાય છે?

ઉણખા યાદ અડતાલીસ કલાક રાખીને અગ્નિઅસ્ત્ર દવા તરીકે

ઉણખા યાદ અડતાલીસ કલાક રાખીને અગ્નિઅસ્ત્ર દવા તરીકે વાપરવામાં આવી હતી.

ઉણખા યાદ અડતાલીસ કલાક રાખીને અગ્નિઅસ્ત્ર દવા તરીકે વાપરવામાં આવી હતી.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

સુગાનામાં સ્વામિન્ય પહેલા પાળાનું યાત્રુ

સુગાના મુલ્યાની વિરુદ્ધ સંગઠનના સભ્ય દેશીના વિદેશ મંત્રીઓની બેઠક આરોપી કરી હતી. ગોવામાં મળેલી આ બેઠકમાં તમામ સભ્ય દેશીના વિદેશ મંત્રી વ્યક્તિગત રીતે સામેલ થયા હતા જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ભિલાવેલે ટુટ્ટે ગઈરી પત્ર હાથર રહ્યા હતા. ભિલાવેલે એસીઆઈની બેઠકમાં ભાગ લેવા માટે જ મેનાં રોજ યાત્રા આપ્યા હતા, જે વર્ષ ૨૦૧૧ પછી પાકિસ્તાનના કોઈ મોટા નેતાની પહેલી યાત્રા આવી હતી.

પર પ્રકાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જો સ્ત્રીયોગ મારા હાથમાં છે તો તેમને શા માટે દુઃખ થાય છે?

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૩.૧૬ ટકા પરિણામ

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.

વલસાડ જિલ્લામાં ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર કરાયું છે.